



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૬/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૪૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦૨ કેસ કરી, ૭૫ વ્યક્તિઓને ઝડપી, ૩૯૭ લીટર દેશી દારૂ, ૦૩ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૨ મોટર સાયકલ કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૭ કેસ કરી ૩૨ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૨,૦૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૫૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૦ અને પાસા હેઠળ ૦૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૯૫૧/૧૯

સોલા હાઇકોર્ટ : ચંન્દ્રાવલી ગણપતસિંહ ગઢવી (ઉ.વ.૨૬)(રહે.બી-ટાઇપ સોલા સરકારી વસાહત, સોલા સીવીલની બાજુમાં, સોલા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૬/૨૦૧૯ બપોરના ૧૨/૦૦ થી સાંજના ૬/૦૦ સુધીના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૪૨,૦૦૦/-મતાની ચોરી કરી લઈ ગઈ છે.આ ગુનાની તપાસ પોસ.શ્રી વી.કે.મકાવાણા ચલાવે છે

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૫૨/૧૯

બાપુનગર : વાસુદેવભાઈ ચીમનલાલ પંડ્યા (ઉ.વ.૭૩)(રહે,ખાડાવાળો વાસ જહાંગીરપુરા પાસે સિવીલ હોસ્પિટલ રોડ) તા.૩૦/૦૪/૧૯ બપોરના ૦૩/૩૦ વાગ્યાના સુમારે બાપુનગર ડી-માર્ટ પાસેથી ઓટોરીક્ષા નંબર જીજે-૨૭-વાય-૧૪૮૯ માં બેસી પસાર થઈ રહ્યા હતા દરમિયાન ઓટોરીક્ષાના ચાલક અને તેની સાથેનો અજાણ્યો ઇસમ (૨૫ થી ૩૦ વર્ષના આશરના) એ ભેગામળી વાસુદેવભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- મતાની ખેંચી તોડી લઈ, વાસુદેવભાઈને રીક્ષામાંથી નીચે ઉતારી લુંટ કરી નાસી ગયા છે. આ અંગેની ફરીયાદ વાસુદેવભાઈ પંડ્યાએ તા.૨/૬/૧૯ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ગઢવી ચલાવે છે.

કૃષ્ણનગર : મંગલસિંહ ભોપાલસિંહ રાજપુત (ઉ.વ.૩૫)(રહે.રામકૃષ્ણ સોસાયટી, ઉત્તમનગર નીકોલ રોડ ઠક્કરનગર) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૧/૦૬/૧૯ રાતના ૦૮/૪૫ વાગ્યા પહેલા કોઈપણ સમયે ઠક્કરનગર નીકોલ રોડ ઉત્તમનગર રામકૃષ્ણ સોસાયટી ખાતે દુકાનની છતના હુકમાં નાઇલોન નો પટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કેશાભાઇ બબાભાઇ ચલાવે છે.

નારોલ : મમતાબેન વા/ઓ વિકાશભાઇ મીણા (ઉ.વ.૨૫)(રહે.કુમાર કોટન કંપની અંદર નારોલ સ્મશાનની પાછળ નારોલ) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૨/૦૬/૧૯ બપોરના ૦૩/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નારોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.અમલીયાર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.